

જાહેરાત

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ,કમિશનરશ્રી, શાળાઓની કચેરી, બ્લોક નં.૯/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. (રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત)

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૧૮/૦૪/૨૦૧૨ના જાહેરનામા ક્રમાંક:જીએચ/એસએચ/૨/બીએમએસ/૧૧૦૮/૧૮૦૬/ગ તથા શિક્ષણ વિભાગના તા.૦૨/૦૪/૨૦૧૩ જાહેરનામા ક્રમાંક: જીએચ/એસએચ/ ૬/એસએમએસ/૧૦૧૧/૨૫૮/ગ.૧, તા.૨૩/૦૨/૨૦૧૬ના જાહેરનામા ક્રમાંક:જીએચ/એસએચ/૮ /બીએમએસ/ ૧૧૦૮/૧૮૦૬/ગ, શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:બમશ/૧૧૦૮/૧૮૦૬/ગ, તા.૨૪/૦૨/૨૦૧૬ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને જોગવાઈઓ અન્વયે રાજ્યની રજીસ્ટર્ડ સરકારી માધ્યમિક શાળાઓ (ગુજરાતી માધ્યમ)માં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત વર્ષ-૨૦૧૭ સંદર્ભે રજીસ્ટર્ડ સરકારી માધ્યમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી દ્વારા મળેલી ખાલી જગ્યાઓ મુજબ અંદાજે **કુલ-૧૩૩૫ જગ્યાઓ** નીચે જણાવેલ વિગતે પસંદગીના ધોરણે ભરવા પસંદગી યાદી તથા પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટમાં ઉલ્લેખ કરેલ સુચનાઓ મુજબ શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ **તા.૦૧/૦૨/૨૦૧૭ થી તા.૧૦/૦૨/૨૦૧૭ સુધી www.gserb.org** વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સુચના મુજબ ઓનલાઇન (Online) અરજી કરવાની રહેશે. ભરવાપાત્ર સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકની જગ્યાની વિગતો નીચે મુજબ છે.

સરકારી માધ્યમિક શાળાઓની (ગુજરાતી માધ્યમ)ની અંદાજે કુલ ખાલી જગ્યાઓની જાતિવાર વિગત દર્શાવતું પત્રક

| કુલ જગ્યાઓ | કુલ જગ્યાઓ પૈકી બિન અનામત | કુલ જગ્યા પૈકી અ.જા | કુલ જગ્યા પૈકી અ.જ.જા | કુલ જગ્યા પૈકી સા.શૈ.પ.વ. | કુલ જગ્યા પૈકી શા.ખોડ ખાપણ |
|------------|---------------------------|---------------------|-----------------------|---------------------------|----------------------------|
| ૧૩૩૫ | ૭૫૮ | ૮૮ | ૧૪૦ | ૩૧૯ | ૩૦ |

ઉપરોક્ત જગ્યાઓ પૈકી સરકારશ્રીના વખતો વખતના ઠરાવોની જોગવાઈઓ અન્વયે મહિલા અનામત જગ્યાઓની ભરતી કરવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ પૈકી માજી સૈનિકો માટે ૧૦ ટકા જગ્યાઓ અનામત રહેશે. તદ્ ઉપરાંત માજી સૈનિકની જગ્યાઓ ન ભરાય તો આ જગ્યાઓ ઉપરોક્ત જે તે કેટેગરી વાઇઝ ભરવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓની વિશેષ વિગતો વેબસાઇટ ઉપર રજુ કરેલ છે. પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજીત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગઘટાડા તથા અન્ય વહીવટી/આકસ્મિક કારણોસર જગ્યા રદ થતા, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઇ હકકદાવો રહેશે નહીં. ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારને મેળવેલ ગુણવત્તા ક્રમ અનુસાર પસંદગીની તક ઉભી થશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-૨૦૧૪ માં આપવામાં આવેલ TAT ની પરીક્ષા યોજવા અંગે આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને લેવાયેલ પરીક્ષામાં ઉર્તિણ થયેલ ઉમેદવારો જ અરજી કરી શકશે.

હાલ ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-૨૦૧૪માં આપવામાં આવેલ TAT પરીક્ષા યોજવા અંગેના જાહેરનામા અનુસંધાને લેવાયેલ પરીક્ષા ધ્યાને લઇ ભરતીની કાર્યવાહી કરવામાં આવશે. પસંદગીના આધારે નિમણૂક મેળવનાર ઉમેદવારોને નામ.ગુજરાત હાઇકોર્ટ સમક્ષના એલ.પી.એ.નં.૧૪૩૦/૨૦૧૫ તથા એલ.પી.એ.નં.૧૪૩૧/૨૦૧૫ના આખરી ચુકાદા બંધનકર્તા રહેશે. પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. તથા પસંદગી સમયે ઉપલબ્ધ ખરેખર ખાલી જગ્યા ઉપર પસંદગી પામેલ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ઉમેદવારોએ નિયત ફી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કોઇપણ શાખામાં વેબસાઇટ પર જણાવવામાં આવેલ સુચનાઓ અનુસરીને **તા.૩૦/૦૧/૨૦૧૭થી** ભરવાની રહેશે. જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સુચનાઓ **www.gserb.org** વેબસાઇટ ઉપર **તા.૨૭/૦૧/૨૦૧૭ ના** રોજ મુકવામાં આવશે. **શિ.વિ.ના તા.૨૪/૦૧/૨૦૧૭ના પત્રથી સરકારી માધ્યમિક વિભાગમાં મહત્તમ વયમર્યાદા ૩૭ વર્ષ કરવામાં આવેલ છે. અને અનામત કક્ષાના ઉમેદવારો માટે નિયમાનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.**

(પી.એમ.જીષીયારા)

સભ્ય સચિવ, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ.મા. શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ અને સંયુક્ત શિક્ષણ નિયામક(માધ્યમિક), કમિશનર, શાળાઓની કચેરી, ગુ.રા., ગાંધીનગર.